

ત્વરિત જાહેરાત માટે

## જૂન દરમ્યાન પ્રથમ વખત વરિષ્ઠોના પ્રશંસા દિનને માન્યતા અપાશે જે બ્રેમ્પટન ખાતે સિનિયર્સ મન્થ ગણવામાં આવે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (16 જૂન 2020) – મે 27 ના રોજ, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે પ્રસ્તાવ પસાર કર્યો કે એક સમર્પિત દિવસે બ્રેમ્પટનના વરિષ્ઠોના અનેક યોગદાનનું સન્માન કરવામાં આવે. આ વર્ષે, બ્રેમ્પટન સિનિયર સિટિઝન્સ કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ જૂન 19 ને બ્રેમ્પટનમાં સિનિયર્સ અપ્રિસિએશન ડે તરીકે ઘોષીત કરવામાં આવે જે જૂનના સિનિયર્સ મન્થના ભાગરૂપે હશે.

જૂન 19 ના રોજ સવારે 11 વાગ્યાથી મધ્યાહન સુધી એક વિશિષ્ટ સિનિયર્સ અપ્રિસિએશન ડે ટેલિ ટાઉન હોલ યોજાશે. પ્રોગ્રામમાં મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) સ્વાગત પ્રવચન કરશે, એક પૂર્વેથી રેકોર્ડ કરેલ બ્રેમ્પટન કન્સર્ટ બેન્ડનો કાર્યક્રમ દર્શાવાશે અને પેરાલિમ્પિઅન અને વિશ્વ ચેમ્પિયન જેક ઓડમ્સનું પ્રેરણાદાયક વક્તવ્ય હશે. COVID-19 ના રોગચાળાના પડકારોનો જ્યારે આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે પીલ પબ્લિક હેલ્થ અને રિજનલ કાઉન્સિલરો પેટ ફોર્ટિની અને ગૂરપ્રીત ધિલ્લોન સાથે વરિષ્ઠોને વાત કરવાની તક સાંપડશે જેઓ COVID-19 સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સના સહ પ્રમુખો છે.

કોલમાં જોડાવા માટે વરિષ્ઠો ગુરુવાર, જૂન 18 સુધીમાં પોતાનો ફોન નંબર રજિસ્ટર કરાવવા 311 પર કોલ કરી શકશે. લાઈવ ઓડિયો સ્ટ્રીમ ઓનલાઈન મળતી રહેશે.

### જૂન બ્રેમ્પટનમાં સિનિયર્સ મન્થ છે

#### સિનિયર્સ માટે ઓનલાઈન પ્રવૃત્તિઓ

વરિષ્ઠો માટે સર્જયેલ શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ ઓનલાઈન ઉપલબ્ધ છે જેમાં સમાવેશ થાય છે ફિટનેસ વિડિયોઝ, એક્ટિવિટી શીટ્સ, ઉખાણા અને ઘણું બધું અહીં મળશે [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation).

#### કમ્યુનિટી મોઝેક પ્રોજેક્ટ

સિનિયર્સને અર્થપૂર્ણ કમ્યુનિટી મોઝેક પ્રોજેક્ટમાં ભેગા લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેમને માટે "સામાજિક મૈત્રી" શું છે તે કેદ કરી શકાય. રજિસ્ટર થાવ એટલે સહભાગીઓને એક આર્ટ કિટ પ્રાપ્ત થશે જેમાં સામેલ હશે 4' x 4' સિરેમિક ટાઈલ, એક્ટિવિક પેઈન્ટ સેટ અને પેઈન્ટબ્રશ. સંદેશ હોય કે કોઈ ચિત્ર, વરિષ્ઠો "મૈત્રી"નું તેમનું અર્થઘટન તેમને લાગે તે રીતે પ્રસ્તુત કરી શકશે. સિટીના સ્વયંસેવકો ટાઈલ્સ ભેગી કરશે અને જુલાઈમાં આખા મોઝેકને જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવશે. વરિષ્ઠો પુરવઠો મેળવવા માટે 311 પર કોલ કરીને

અથવા [covid19seniors@brampton.ca](mailto:covid19seniors@brampton.ca) પર ઈમેલ કરીને રજિસ્ટર કરાવી શકશે. રજિસ્ટર કરવાની સમાપ્તિ તારીખ જૂન 19 છે.

વિગતો અહીં ઉપલબ્ધ છે [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation).

**સિનિયર્સ કફે કૉલ-ઇન ચેટ્સ**

COVID-19 ના ભૌતિક અંતરના પગલાંને કારણે લાગેલ એકલતાનો સામનો કરવા વરિષ્ઠો હવે પોતાના ઘરેથી જ અન્ય વરિષ્ઠો સાથે હળીમળી શકશે. સિટી ઓફ બ્રમ્પટનના સહયોગથી ફ્રી ટેલિફોન પ્રોગ્રામ મારફત વરિષ્ઠો વિશેષ વિષય પર ચર્ચા કરી શકશે, રમતો રમી શકશે કે સામાન્ય વાર્તાલાપો કરી શકશે. તારીખ સેટ કરવા અને તેમને માટે અનુકૂળ સમય નક્કી કરવા વરિષ્ઠો 905.874.3348 પર કોલ કરી શકશે.

**COVID-19 દરમિયાન વરિષ્ઠો માટે વધારાની મદદ**

COVID-19 રોગચાળા દરમિયાન, COVID-19 સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ દ્વારા ગ્રોસરીની ડિલિવરીમાં જરૂરિયાતમંદ વરિષ્ઠોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. વરિષ્ઠો ગ્રોસરીનો ઓર્ડર 311 પર કોલ કરીને અથવા [covid19seniors@brampton.ca](mailto:covid19seniors@brampton.ca) પર ઈમેલ કરીને આપી શકશે. પેમેન્ટ કાર્ડ ન હોય એવા લોકો વતી સિટી પોતાના ગ્રોસરી પાર્ટનરો મારફત ચૂકવણી કરે છે. સ્વયંસેવકો ગ્રોસરી રહેવાસીના દ્વારે ડ્રોપ કરે છે અને તેમની ગ્રોસરીની ઈનવોઇસ ચૂકવની માટે 30 દિવસની અંદર તેમને મોકલવામાં આવે છે.

સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ 690 પૂછપરછોનો જવાબ આપી ચુક્યા છે અને COVID-19 નો સામનો કરવાના રૂપે બ્રમ્પટનમાં 200 કરતા વધુ ગ્રોસરી અને દવાની ડિલિવરી કરી ચુક્યા છે. પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ ધરાવતા આશરે 1,600 કેર પેકેજ વરિષ્ઠોને વિતરિત કરવામાં આવી રહ્યા છે અને 90 કરતા વધુ વરિષ્ઠોના સંગઠનો આખા બ્રમ્પટનમાં સિટીની એજ-ફેન્ડલી કમિટી મારફત પ્રવૃત્ત કરવામાં આવેલ છે.

વરિષ્ઠો કોઈપણ સમયે 311 પર કોલ કરીને સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સનો સંપર્ક કરી શકે છે અથવા અહીં ઈમેલ કરી શકે છે [covid19seniors@brampton.ca](mailto:covid19seniors@brampton.ca) જેથી આવા મુશ્કેલીભર્યા સમયમાં મદદ મળી શકે.

**પૃષ્ઠભૂ**

આપણા સમાજની વરિષ્ઠ વસ્તીને સીટી ઓફ બ્રમ્પટન પ્રવૃત્ત કરીને તેમની કદર કરવાનું ચાલુ રાખી રહ્યું છે. એજ-ફેન્ડલી સ્ટ્રેટજી મારફત સિટી જીવનના તમામ તબક્કાઓમાં રહેલ રહેવાસીઓની અનન્ય જરૂરિયાતો પર પૂર્ણ અને ટકાઉ સમુદાયોની રચના અને વિકાસ મારફત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રોવિન્સ ઓફ ઓન્ટારીયોએ જુનને સિનિયર્સ મન્થ તરીકે ઘોષીત કર્યો તેનું આ 36 મું વર્ષ છે.

**અવતરણો**

"બ્રમ્પટનના વૈવિધ્યસભર અને વિકાસ પામતા સમાજમાં વરિષ્ઠો આશરે 11 ટકા જેટલા છે, અને આ જુન માસમાં વડીલોની કદર કરતા મને ગૌરવની લાગણી થાય છે. બ્રમ્પટન દીર્ઘ વયીન લોકો સાથે મૈત્રીભાવ કેળવવામાં અગ્રેસર છે અને વરિષ્ઠો આપણા શહેરને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સિટી તે સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે જેથી વરિષ્ઠોનું સ્વમાન જળવાય અને તેઓ પ્રવૃત્ત રહે અને તેમને સ્વસ્થ રહેવા માટે જોઈએ તે મદદ મળી રહે. હું બધાંને પોતાની ફરજ બજાવવા પ્રોત્સાહિત કરું છું અને આ મહિને ભૌતિક અંતરની પ્રણાલિઓ ધ્યાનમાં રાખીને વરિષ્ઠોને વધાવી લે.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"વરિષ્ઠો આપણા સમાજના પાયારૂપ છે અને અમે તેમને વધાવી લેવા અને તેમની કદર કરવામાં અમે હરણકાળ ભરી રહ્યા છે. બ્રમ્પટન સિનિયર સિટિઝન્સ કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ મને જણાવતા ગૌરવ થાય છે કે બ્રમ્પટન સીટી કાઉન્સિલે સર્વાનુમતે મારા પ્રસ્તાવને ટેકો આપ્યો

જેથી સિનિયર્સ મન્ય દરમિયાન સિનિયર્સ ડે નું સર્જન કરી શકે. આ સમર્પિત દિવસે અમે આપણા વરિષ્ઠો પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તેઓએ બ્રમ્પટનમાં તેમજ બહાર જે હાંસલ કર્યું છે તેની કદર કરીશું."

**માર્ટિન મેડિરોસ (Martin Medeiros)** રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4, સિટી ઓફ બ્રમ્પટન

"દર વર્ષે, સિટીના કર્મચારીગણ જુનમાં સિનિયર્સ મન્ય ઉજવવાની પ્રવૃત્તિઓ યોજે છે. આ વર્ષે, સિટી COVID-19 ની અસરોથી અનુરૂપ થઈને ઉજવણીઓ ઓનલાઈન કરશે. કોલ-ઈન ચેટ્સથી ઓનલાઈન પ્રવૃત્તિઓ, પ્રશિક્ષણ આપતા ક્વિઝનેસના વિડિઓ જેવી બાબતો રાખીને અમે આખા મહિના દરમિયાન અમારા વરિષ્ઠો સાથે અર્થપૂર્ણ રીતે પ્રવૃત્ત થઈએ છીએ અને તેમની સાથે સંબંધ બનાવીએ છીએ."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)